

RAN-1901000601010001
M.A. (External) Part-I Examination March - 2026
Economics - Micro Economics (Paper-I)
Time: 3 Hours]
[Total Marks: 100

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) બધા જ પ્રશ્નો ફરજિયાત છે. All Questions are compulsory. (3) જમણી બાજુના અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે. Figures to the right indicate full marks of the question.	Seat No.: Student's Signature
---	---

- પ્ર. 1** સેમ્યુલ્સનના અભિવ્યક્ત પસંદગીના સિદ્ધાંતનું ટીકાત્મક પરીક્ષણ કરો. (20)
અથવા
 (A) પુરવઠાની મૂલ્યસાપેક્ષતા (10)
 (B) સમતૃપ્તિ વક્રનાં લક્ષણો. (10)
- પ્ર. 2** ઉત્પાદન વિધેય એટલે શું ? ઉત્પાદક કઈ રીતે ન્યૂનતમ ખર્ચ સંયોજન પર પહોંચે છે, તે આકૃતિની મદદથી સમજાવો. (20)
અથવા
 CES ઉત્પાદન વિધેય સવિસ્તાર સમજાવો. એની સમીક્ષા કરો. (20)
- પ્ર. 3** ઈજારાયુક્ત હરીફાઈની લાક્ષણિકતાઓ વર્ણવો. ઈજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીની ટૂંકગાળાની સમતુલા આકૃતિની મદદથી સમજાવો. (20)
અથવા
 અલ્પહસ્તક ઈજારા બજારમાં કુર્નોટ મોડલ આકૃતિની સહાયથી સમજાવો. (20)
- પ્ર. 4** વહેંચણીના સીમાન્ત ઉત્પાદકતાના સિદ્ધાંતની સમીક્ષાત્મક ચર્ચા કરો. (20)
અથવા
 રાષ્ટ્રીય આવકની વહેંચણીના રિકાર્ડોના સિદ્ધાંતની ચર્ચા કરી તેને ટીકાત્મક રીતે ચર્ચો. (20)
- પ્ર. 5** (A) પીગુનું કલ્યાણકારી અર્થશાસ્ત્ર (10)
 (B) એરીનું અશક્યતા પ્રમેય (10)
અથવા
 પેરેટોની ઈષ્ટ અવસ્થા એટલે શું ? પેરેટોની ઈષ્ટ અવસ્થા પ્રાપ્ત કરવાની શરતો સમજાવો. (20)

ENGLISH VERSION

- Q.1.** Evaluate critically Samuelson's revealed preference approach. (20)
OR
- (A) Elasticity of Supply. (10)
(B) Characteristics of Indifference Curve. (10)
- Q. 2** What is production function? How producer arrives at least cost combination? (20)
Explain it with the help of diagram.
OR
Explain in detail the CES production function. Critically evaluate it. (20)
- Q. 3** Describe characteristics of monopolistic competition, Explain short run (20)
equilibrium of firm in monopolistic competition with the help of diagram.
OR
Explain with the help of diagram cournot model in Oligopoly market. (20)
- Q. 4** Critically discuss the Marginal Productivity Theory of distribution. (20)
OR
Discuss the Recardian" theories of distribution of national income and its (20)
Discuss Critically.
- Q. 5** (A) Pigu's Welfare Economics. (10)
(B) Arrows impossibility theorem (10)
OR
What do you mean by Pareto Optimality? Explain conditions to achieve Pareto (20)
Optimality.
-